

This Question Paper contains 12 printed pages.  
(Sections - A, B, C & D)

Sl.No. 07979

11(G)  
(MARCH, 2020)  
(New Course)

Time : 3 Hours]

[Maximum Marks : 80

સૂચનાઓ :

- 1) સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જળવવું.
- 2) આ પત્રમાં ચાર વિભાગ A, B, C અને D તથા 1 થી 39 પ્રશ્નો છે.
- 3) બધા ૭ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે.
- 4) પ્રશ્નની જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે.
- 5) સૂચના પ્રમાણે આકૃતિઓ સ્વચ્છ, સ્પષ્ટ અને પ્રમાણસર દોરવી.
- 6) નવો વિભાગ નવા પાના પર લખવો. પ્રક્રિયાના જવાબ ફરજમાં લખવા.

વિભાગ - A

નીચે આપેલા પ્રશ્ન નં. 1 થી 16 ના માઝા મુજબ જવાબ આપો.

(દરેક સાચા વિધાનનો 1 ગુણ)

[16]

આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાતી જગ્યા પૂરો.

- 1)  $ZnO + C \rightarrow Zn + CO$  માં ..... નું રિંડજન થાય છે. [1]
- 2) બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ..... કિયારીલ સમુહ આવેલો છે. [1]
- 3) બ્રોકલી ..... દ્વારા કૃત્રિમ પસંદગી દ્વારા વિકસાવાય છે. [1]
- 4) આપણા આહારમાં ..... ની કમીથી ગોઈટર રોગ થાય છે. [1]

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.

5) સાબુના આણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. [1]

6) ઓપ્ટિશિયને ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર  $-0.4D$  છે. તો તે લેન્સનો પ્રકાર બહિગોળ છે. [1]

7) પરાવર્તી કિયાનું સંચાલન હદ્ય દ્વારા થાય છે. [1]

આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રક્રો માટે સાચા વિકલ્પનો ફર્મ અને જવાબ લખો.

8) નીચેનામાંથી ક્યું તત્ત્વ નિર્જીવ વાયુના ગુણધર્મો ધરાવતું નથી. [1]

(A) H

(B) He

(C) Ne

(D) Ar

9) નીચે આપેલ પૈકી માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી ? [1]

(A) અંડાશય

(B) ગર્ભાશય

(C) શુક્રવાહિની

(D) અંડવાહિની

10) શેસિલ ડેટીંગ પદ્ધતિનો ઉપયોગ શા ના માટે કરવામાં આવે છે.

[1]

- (A) ભૂમિનું સ્તર બંધારણ નક્કી કરવા
- (B) અશ્મિઓની ઉંમરનો અંદાજ મેળવવા
- (C) અશ્મિઓનું બંધારણ નક્કી કરવા
- (D) કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરવા

11) સામાન્ય દષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દષ્ટિ અંતર આશરે ..... છે.

[1]

- (A) 25 m
- (B) 2.5 cm
- (C) 25 cm
- (D) 2.5 m

આપેલા પ્રશ્નોના માઝ્યા મુજબ જવાબ આપો.

12) આધુનિક આવર્ત કોષ્ટકમાં મારુ સ્થાન ત્રીજ આવર્ત અને બીજા સમુહમાં છે. બોલો હું ક્યું તત્ત્વ છું? [1]

13) ચંદ્રના પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી ક્યા પ્રકારની સામુદ્રિક ઊર્જા મળે છે? [1]

14) વિદ્યુત પ્રવાહનો SI એકમ ક્યા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે?

[1]

15) માનવ આંતરડામાં ક્યા પ્રકારના જવાણું મળી આવે છે?

[1]

વાક્ય પૂર્ણ કરો.

16) ડિસ્પોઝેબલ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવો/બંધ કરવો જોઈએ કારણ કે.....

[1]

વિભાગ - B

નીચે આપેલા પ્રશ્ન નં. 17 થી 26 ના આશરે 40 થી 50 શબ્દોમાં માણ્યા મુજબ ઉત્તર લખો.  
(પ્રત્યેક સાચા જવાબના 2 ગુણ)

[20]

17) એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અસ્પમાત્રામાં બેઝિંગ સોડા ઉમેરે છે? [2]

- (a) તે તાજા દૂધની pH ને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે?
- (b) શા માટે આવું દૂધ દહી બનવા માટે વધુ સમય લે છે?


18) વૈજ્ઞાનિક કારણ આપો.

એલ્યુમિનિયમ ધાતુ નાઈટ્રોક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. [2]

19) ન્યુલેન્ડના અષ્કના નિયમની મર્યાદા જણાવો. (કોઈપણ બે) [2]

અથવા

19) બીજા આવર્તનાં તત્ત્વ માટે પરમાણ્વીય ત્રિજ્યા  $\rightarrow$  પરમાણ્વીય કમાંકના આદેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.



- (a) બીજા આવર્તનાં સૌથી વધુ ધાતુ ગુણધર્મો ક્યું તત્ત્વ ધરાવે છે?
- (b) બીજા આવર્તનાં સૌથી ઓછું પરમાણ્વીય કદ કયા તત્ત્વનું છે?

20) પ્રકાશ સંસ્કેરણની કિયાનું રાસાયણિક સમીકરણ લખો.

[2]

અથવા

20) તર્ફાવત આપો :

જરક શ્વસન અને અજરક શ્વસન.



21) યૌવનારંભના સમયે છોકરીઓમાં ક્યા પરિવર્તનો જોવા મળે છે?

[2]

22) વાહનની પાછળનું દશ્ય જોવા માટે ક્યા પ્રકારનો અરીસો વપરાય છે. તમારો જવાબ કારણ સહિત સમજાવો.

[2]

23)



(C)



આ સંજ્ઞા દર્શાવતા ઘટકોનો ઉપયોગ કરી એક નામ નિર્દેશિત સાદો વિદ્યુત પરિપथ રચો.

[2]

અથવા

23) તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100W અને રેફિજરેટર 400W નું રેટિંગ ધરાવે છે. જો આ ઉપકરણો 10 કલાક / દિવસ ચલાવવામાં આવે છે તો 8 રૂપત્રી KWh ના લેખે 10 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય?


- 24) ઘરેલું વિદ્યુત - પરિપથમાં ઓવર લોડિંગને નિવારવા માટે કઈ સાધાની રાખવી જોઈએ? [2]
- 25) તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો. કોઈપણ બે પદ્ધતિઓના નામ આપો. [2]
- 26) પર્યાવરણને બચાવવા માટેના બે Reuse (પુન: ઉપયોગિતા) અને Recycle (પુન: ચક્કાકરણ) વિષે સમજાવો.  
અથવા
- 26) મોટા બંધની પરિયોજનાઓના વિરોધમાં કઈ પાયાની સમસ્યાઓ કારણભૂત છે? સમજાવો (કોઈપણ બે)

### વિભાગ - C

નીચે આપેલા પ્રશ્ન નં. 27 થી 34 ના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. (પ્રત્યેક સાચા જવાબના 3 ગુણા)

- 27) પદ્ધતિ 'X' નું દ્રાવણ ધોળવા (White Washing) માટે વપરાય છે. [3]
- પદ્ધતિ 'X' નું નામ આપો.
  - પદ્ધતિ 'X' નું રાસાયણિક સૂત્ર લખો.
  - પદ્ધતિ 'X' ની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો.
- 28) તાંબુ (કોપર) ના શુદ્ધિકરણની વિદ્યુતવિભાજનની પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો. [3]  
અથવા
- 28) થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો.

29)



આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

[3]

(a) "A" નિર્દેશિત રૂચના ઓળખો તેનું કાર્ય જણાવો.

(b) "B" નિર્દેશિત રૂચના ઓળખો તેનું કાર્ય જણાવો.

30) અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો.

[3]

31) સમજાવો:

સમભૂલક અંગો અને કાર્યસદ્ધા અંગો અને બંનેના એક એક ઉદાહરણ આપો.

[3]

અથવા

31) રમેશને 2 પુત્રિઓ છે. તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશની પુત્ર મહેન્ધાને લીધે માયાને સેનોઓફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે તો.

(a) પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ? પિતા કે માતાનું રંગસૂત્ર?

(b) રમેશની 2 પુત્રીના કિસ્સામાં ક્યું રંગસૂત્ર આનુવંશિકતાની દિલ્લિએ પ્રાપ્ત થયું ન હોતું

(c) ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે? શા માટે?

- 32) અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને C અને F ની વચ્ચે મૂકૃતાં મળતાં પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવો. [3]

અથવા

- 32) 4.0 cm ઊંચાઈની વસ્તુ કોઈ 15.0 cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25.0 cm અંતરે રાખેલ છે. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે તેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? પ્રતિબિંબનો પ્રકાર તથા તેની ઊંચાઈ શોધો.

- 33) અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. [3]

- 34) અતુલભાઈનું વીજળીનું બિલ ઘણું વધારે આવે છે. સચીનભાઈ તેમને સરકારશ્રી ની સબસીડીનો લાભ લઈ સોલર પેનલ લગાવવા માટે સલાહ આપે છે. એમ કરવાથી તેમના વીજળીના બિલમાં ઘણો ફાયદો થયો. [3]

(a) સોલર પેનલમાં ઉર્જનું ક્યું રૂપાંતરણ જોવા મળે છે?

(b) એક (1) સોલર સેલમાંથી આશરે કેટલા W વિદ્યુત પાવર પેદા થાય છે?

(c) સૌર ઉર્જા આધારિત સોલર પેનલની મર્યાદા જણાવો.

વિભાગ - D

નીચે આપેલા પ્રશ્ન નં. 35 થી 39 ના આશરે 90 થી 120 રાખ્દોમાં માઝ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. (પ્રત્યેક સાચા જવાબના 4 ગુણ) [20]

- 35) રસોડામાં તમારી ભર્મી કરકરા (કિસ્પી) પકોડા કે કે બનાવવા માટે ક્યું રસાયણ વાપરે છે? તેનું નામ લખો. તેની બનાવટ રસાયણિક સમીકરણ સાથે લખો. [4]

અથવા

- 35) દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યૂરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રથોગનું આકૃતિ સાથે વર્ણન કરો. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો.

- 36) (a) નીચે આપેલ કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્રો લખો.

i) બેન્કીન

ii) ક્લોરો-પ્રોપેન

- (b) એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો. [4]

- 37) મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામનિર્દેશવાળી આકૃતિ દોરી તેમાં ઇધિરનું પરિવહન સમજાવો. [4]

- 38) છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? તેનું નિવારણ આકૃતિ સહ વર્ણવો. [4]

39) વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત, કાર્યપદ્ધતિ અને ઉપયોગ આકૃતિ સહ વર્ણવો.

[4]

અથવા

39) વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાપ્તા આપો. તાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંઘણાને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને

- (a) ગૂંઘણાની અંદર ધકેલીએ
- (b) ગૂંઘણાની બહાર કાઢીએ અને
- (c) ગૂંઘણાની અંદર સિથર રાખીએ તો ગેલ્વેનોમીટરમાં શું થશે?

